

Date: 29th October, 2021

To,

<p>The Listing Department BSE Limited P. J. Towers, Dalal Street, Mumbai – 400 001 Fax : 02222721234 Email : corp.relations@bseindia.comp</p> <p>Scrip Code: 533301</p>	<p>The Listing Department National Stock Exchange of India Limited Exchange Plaza, C-1, Block G, Bandra Kurla Complex, Bandra (E), Mumbai – 400 051 Fax : 02226598237/38 Email : cmlist@nse.co.in</p> <p>Scrip Symbol: SPYL</p>
--	--

Sub : Newspaper Advertisement - Disclosure under Regulation 30 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (“SEBI Listing Regulations”)

Dear Sir/Madam,

Pursuant to Regulation 30 read with Schedule III Part A Para A of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 we enclose the copies of newspaper advertisements published in Financial Express English and Financial Express Gujarati, Ahmedabad Addition for publishing of Financial Results for the Quarter and Half Year Ended on 30.09.2021.


The above information is also available on the website of the Company www.shekhawatiyarn.com

This is for your information and records.

Thanking You,

Yours faithfully,

For Shekhawati Poly-Yarn Limited


Meena Agal
Company Secretary



Encl : As above

Shekhawati Poly-Yarn Ltd.

Registered Office

Survey No. 185/1, Near Kanadi Phatak, Village - Naroli, Silvassa, D & N H. -396 235, India

72260 71555 Email : info@shekhawatiyarn.com CIN : L17120DN1990PLC000440 GST : 26AABCS5224N1Z6

Corporate Office

Express Zone 'A' Wing, Unit No. 1102/1103, 11th Floor, Near Patel Vatika, off W. E. Highway

EXPORT HOUSE

ISO certified company

SOUTH INDIAN Bank
4th floor, Sakar VII, Nehru Bridge Junction, Ashram Road, Navrangpura, Ahmedabad, Gujarat - 380 006
Phone: 079 - 2658 5600, 5700, 1600
Email: ro1018@sib.co.in

POSSESSION NOTICE
(For immovable property) [See rule 8 (1)]

Whereas, the undersigned being the Authorised Officer of The South Indian Bank Ltd. under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 05.06.2021 u/s. 13(2) of the Act calling upon the borrower, **Mr. Ramesh Kumar Singhvi, S/o. Mohanlal Jeakchand Singhali, Proprietor, M/s. Galaxy Prints, F-3397-98, Global Textile Market, Near Seminar Hospital, Sahara Darwaja, Ring Road, Surat, Pin-395002, also at # 4078/79, Radha Krishna Textile Market, Ring Road, Surat, Pin-395002, also at # 4069/99, Radha Krishna Textile Market, Ring Road, Surat, Pin-395002, and guarantors, (1) Mr. Mohanlal Jeakchand Singhali, (2) Ms. Manjudevi Rameshkumar Singhvi, (3) Mr. Manjulaben Rameshbhai Singhvi, W/o. Ramesh Kumar Singhvi, all residing at Flat No. C-305, 3rd Floor, Surya Cooperative Society Ltd., Surya Complex, Near Ashirwad Park, City Light, Surat, Pin-395007, to repay the amount mentioned in the notice being **Rs. 1,03,52,143.81 (Rupees One Crore Three Lakh Fifty Two Thousand One Hundred Forty Three and Paise Eighty One only)** with further interest and costs within 60 days from the date of receipt of the said notice.**

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken **symbolic possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 of the Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the 21st day of October 2021.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the Property and any dealings with the property will be subject to the charge of The South Indian Bank Ltd. for an amount of **Rs. 1,07,63,096.21 (Rupees One Crore Seven Lakh Sixty Three Thousand Ninety Six and Paise Twenty One)** as on 20.10.2021 and interest and costs thereon.

The borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY

All that part and parcel of flat bearing No. C-305 on the 3rd floor of 'Surya Co-operative Housing Society Ltd.' admeasuring approximately 2090 Sq. Ft. constructed on land bearing R.S.No.153/1 Paikae, Plot No.1 to 11, T.P.S.No.4, (Umra-South) F.P.No.110/2 at Umra, Taluka Choryasi, District Surat, **owned jointly by Mr. Mohanlal Jeakchand Singhali and Manjulaben Rameshbhai Singhvi**, vide society Share Certificate No. A/124 and Allotment letter, both dated 03.05.2001, issued by M/s. Surya Co-Operative Housing Society Ltd. (Regd. No.16426 dated 20.07.1994) bounded by:

North : Passage & Flat No.306, South : Open Space
East : Open Space, West : Open Space

Date : 21.10.2021
Place : Surat

Authorised Officer
The South Indian Bank Ltd.

FINANCIAL EXPRESS

Felix FELIX INDUSTRIES LIMITED
(CIN: L40103GJ2012PLC072005)

Registered Office: 208, Devshruti Complex, Opp. Medisurge Hospital Nr. Mithakali Cross Road, Ellisbridge Ahmedabad - 380006, Gujarat
Email: cs@felixindustries.co; Website: www.felixindustries.co

PUBLIC NOTICE

The Company has received mail form the National Stock Exchange of India Limited (NSE) informing circulation of "Unsolicited SMS" with reference to the equity shares of the Company to induce investment in the equity shares of the Company indicating target prices, by some unregistered or unauthorized entities.

We would like to categorically clarify that the Company, its Promoter, Promoter Group, Directors and KMPs do not have any role in circulation of such messages by unknown persons/entities. As we came to know from NSE about it, the Company is under process to lodge the Police Complaint regarding the same.

All shareholders and Investors are hereby advised/cautioned not to rely on such unsolicited messages/SMSs circulated by unauthorized entities. We also advise shareholders and investors to exercise appropriate due diligence before trading and/or investing in the shares of the Company and to take informed investment decision without being influenced by any such unsolicited messages/SMSs. If any investors deals in the shares of the Company based on such Messages/SMSs or incur losses, the Company, its Promoters, Directors and any Officer of the Company will not be responsible or liable for the same.

The Company is making all requisite disclosures from time to time and same are uploaded on the website of the NSE and also on the website of the Company.

We strongly advise the investors to go through only NSE website i.e. www.nseindia.com for any news and/or disclosures relating to the Company. For any information and/or clarification from the Company, the investors can contact with the Company at cs@felixindustries.co.

For, Felix Industries Limited
Sd/-
Ritesh Patel (Managing Director)
(DIN : 05350896)

Date : 27.10.2021
Place : Ahmedabad

Aavas FINANCIERS LIMITED
(Formerly known as Au HOUSING FINANCE LIMITED) [CIN:L65922RJ2011PLC034297]
Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Manisarvar Industrial Area, Jaipur. 302020

POSSESSION NOTICE

Whereas, the undersigned being the Authorised Officer of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED") under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(12) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a Demand Notice calling upon the borrowers mentioned herein below to repay the amount mentioned in the respective notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on the dates mentioned as below.

The borrower and guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the property will be subject to the charge of the **AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED")** for an amount mentioned as below and further interest thereon.

Name of the Borrower	Date & Amount of Demand Notice	Description of Property	Date & Type of Possession
Chiragbhai Manharbhai Mistry, Hiteshbhai Manharbhai Mistry, (A/C No.) LNBDRD02218-190090141	4-Mar-20 Rs. 718978/- Dues as on 2-Mar-20	City Survey No. 9,60,61,63,67, Tikka No. 2/3, Vibhag-A, Flat No. 303(TF), Aashish Apartment, Bajawada, Village - Wadi, Sub-District - Vadodara, Gujarat. Admeasuring 320 Sq. Fts.	Physical Possession Taken on 23-Oct-21

Place : Jaipur **Date: 28-10-2021** **Authorised Officer Aavas Financiers Limited**

Union Bank of India
Textile Market Branch
Surat Textile Market, Ring Road, Surat-395002.

SCHEDULE 6, [Rule - 8(1)]
POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the authorized officer of the Union Bank of India Textile Market Branch, Surat under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest (Act) 2002 (3 of 2002) and in exercise of powers conferred under Section 13(2) read with rule 8 and 9 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 01.07.2021 under section 13(2) of the said act calling upon the borrowers **M/s. Shiv Shakti Textile (Borrower), Prop. Mr. Sachin Dharamsing Chaudhary, Mr. Sanjay Budhrakash Sharma (Guarantor) and Mr. Darshan Dhotani alias Darshan Singh (Guarantor)** to repay the amount mentioned in the notice being **Rs.226,48,641/- (Rupees Two Crore Twenty Six Lakhs Four Eight Thousand Six Hundred Forty One Only)** with further interest thereon and expenses within 60 days from the date receipt of the said notice.

The borrower and guarantor having failed to repay the amount, notice is hereby given to the borrower and guarantor and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of said Act read with rule 8 & 9 of the said rules on this the 27th October of the year 2021.

The borrower/secured debtor/ guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Union Bank of India Textile Market Branch, Surat for an amount of **Rs.226,48,641/- (Rupees Two Crore Twenty Six Lakhs Four Eight Thousand Six Hundred Forty One Only)** with further interest thereon plus other charges.

"The Borrower's attention is invited to provision of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets."

Description of the Immovable Property

(1) Hypothecated Stock situated at the unit of M/s. Shiv Shakti Textile situated at B-2080-81, RKT Market Complex, Ring Road, Surat-395002.
(2) All that piece and parcel of the Mortgage of the Plot No.15, Sahaj Row House, surat-Kadodara Road, Magob, surat R.S. No. 34/4, Block No. 64/paik2, Moje-Magob, Tal-Choryasi, Surat in the name of Sachin Dharamsing Chaudhary. Bounded by: North-Plot No.16, South-Plot No.14, East-Road, West- Adj. Property.
(3) All that piece and parcel of the Mortgage of the Plot No.63, Sahaj Row House, surat-Kadodara Road, Magob, surat R.S. No. 34/4, Block No. 64/paik2, Moje-Magob, Tal-Choryasi, Surat in the name of Sachin Dharamsing Chaudhary. Bounded by: North-Plot No. 62, South-Plot No. 64, East-Adj. Property, West-Adj. Road.

Date: 25/10/2021
Place: Surat

Authorized Officer
Union Bank of India

SADBHAV ENGINEERING LIMITED
CIN: -L45400GJ1988PLC011322

Registered Office: "Sadbhav House", Opp. Law Garden Police Chowki, Ellisbridge, Ahmedabad -380006, Gujarat
T:-+91 79 40040000 F:-91 79 40040444
Web: www.sadbhaveng.com E mail: investor@sadbhav.co.in

NOTICE TO SHAREHOLDERS

TRANSFER OF EQUITY SHARES TO INVESTOR EDUCATION & PROTECTION FUND (IEPF) AUTHORITY

Shareholders of the Company are hereby informed that in terms of section 124(6) of the Companies Act, 2013 and Investor Education and Protection Fund Authority (Accounting, Auditing, Transfer and Refund) Rules, 2016 as amended from time to time, equity shares of the Company in respect of which dividend entitlements have remained unclaimed or unpaid for seven consecutive years or more, are required to be transferred by the Company to the demat account of Investor Education and Protection Fund (IEPF) of the Government of India. Further, unclaimed or unpaid dividend upto the financial year 2012-2013 has already been transferred by the Company to the IEPF in terms of the IEPF Rules, 2016. The concerned members are being provided an opportunity to claim such dividend for the financial year ended on 31-03-2014 (For the F.Y. 2013-2014) and onwards by sending a letter so as to reach at the registered office of the Company or Registrar and Share Transfer Agent (RTA), M/s. Link Intime India Pvt. Ltd., 5th Floor, 506 To 508, Amaranth Business Centre-1 (ABC-1), Beside Gala Business Centre, Near St. Xavier's College Corner, Off C G Road, Navrangpura, Ahmedabad-380009, Gujarat Tel No.: 079-26465179 on or before 25.11.2021. The details viz. names of the concerned members, their folio number and the shares for transfer to the IEPF are available on the Company's website on www.sadbhaveng.com under 'Investors' section. In the event valid claim is not received by Company or its RTA on or before 25.11.2021, the Company shall take action towards transfer of such shares to IEPF thereafter.

It may also be noted that the shares transferred to IEPF, including all benefits accruing on such shares, if any, can be claimed back from the IEPF Authority as per the procedure prescribed by the IEPF Rules. Individual letters in this regard have been sent to the concerned members at their latest registered addresses available with the Company. Clarification on this matter, if required, may be sought from the Company or RTA by sending email at investor@sadbhav.co.in or by calling them at +91 079-4040400.

For, Sadbhav Engineering Limited
Sd/-
(Hardik Modi)
Company Secretary

Place: Ahmedabad
Date : 27th October, 2021

Muthoot Homefin (India) Ltd
Corporate Office : 1201 & 1202, 12th Floor, 'A' Wing, Lotus Corporate Park, Off. Western Express Highway, Goregaon (East), Mumbai - 400 063.

POSSESSION NOTICE

(As per Appendix IV read with rule 8(1) of the Security Interest Enforcement Rules, 2002)

Whereas, the undersigned being the Authorized Officer of Muthoot Homefin (India) Ltd. (MHIL) under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, Demand Notice(s) issued by the Authorised Officer of the company to the Borrower(s) / Guarantor(s) mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrower having failed to repay the amount, notice is hereby given to the Borrower(s) / Guarantor(s) and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Muthoot Homefin (India) Ltd. for an amount as mentioned herein under with interest thereon.

The Borrower's attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Name of the Borrower(s)/ Co-Borrower(s)/ Loan Account No./Branch	Description of secured assets (Immovable property)	Date of Demand Notice & Total Outstanding Dues (Rs.)	Possession Taken Date
1	Dipak Bhimrav More/ Sahebav Bhimrav More/ 004-00403391 / Surat	410 4th Floor Radhe Residency, Aaradhana Lake Town Vohab-2, Surat Bardoli Road Palsana, Surat, Gujarat, 394305	10-Sep-19 / Rs. 856865/- (Rupees Eight Lac Fifty Six Thousand Eight Hundred Sixty Five Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
2	Dagdu Bhimsingh Girase/ Sarlaben Dagdu Girase / 004-00402658 / Surat	Flat No 302, 3rd Floor, Maruti Palace Sai Darshan Resi. Palsana Bagumara Palsana Surat Gujarat. 394308	13-Jan-20 / Rs. 504825/- (Rupees Five Lac Four Thousand Eight Hundred Twenty Five Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
3	Darshanbhai Dhirubhai Mangliya / 004-00403036 / Surat	Flat No. 502, 5 Th Floor, Main Residency, Block No. 2, Soni Park Housing Society-2, Talithaya, Palsana, Surat-394305	13-Jan-20 / Rs. 536554/- (Rupees Five Lac Thirty Six Thousand Five Hundred Fifty Four Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
4	Hashmukhbhai Vinubhai Chauhan / Renukaben Hashmukhbhai Chauhan / 004-00404844 / Surat	Flat No: 404, 4th Floor, Ambaba Palace, Block No: 121, Near Blue Daine School, Vallabhnagar, Off Surat-Kadodara Road, Varel, Surat- 394140 Gujarat	13-Jan-20 / Rs. 991376/- (Rupees Nine Lac Ninety One Thousand Three Hundred Seventy Six Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
5	Jayeshbhai Gurjyabhai Patel / Chhayaben Jayeshbhai Patel / 004-00405431 / Surat	Flat No 301, 3rd Floor, Madhav Villa Govindaji Park Soc. Block No 123, Nr Sai Darshan Resi, Palsana Surat Gujarat. 394327	13-Jan-20 / Rs. 877545/- (Rupees Eight Lac Seventy Seven Thousand Five Hundred Forty Five Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
6	Kantibhai Hanbhai Bagada / Kailashben Kantibhai Bagada / 004-00405632 / Surat	Plot No 77, Shiv Dhara Residency Vibhag 1, Rs. No 77, Block No 94, Bh Green Off Surat Bardoli Road, Jolwa Surat- 394310	13-Jan-20 / Rs. 1126438/- (Rupees Eleven Lac Twenty Six Thousand Four Hundred Thirty Eight Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
7	Madanmohan Budhadev Sahoo / Mami Madanmohan Sahoo / 004-00404177 / Surat	Flat No- 309, 3 Rd Floor, Madhav Villa, R.S. No. 94, Block No-123, B/H Bharat Petrol Pump, Off Bagumara Canal Road, Govindaji Park Society, Near Sai Darshan Residency, Off Surat Bardoli Highway, Bagumara, Palsana, Gujarat-394327	13-Jan-20 / Rs. 839820/- (Rupees Eight Lac Thirty Nine Thousand Eight Hundred Twenty Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
8	Parmeshwar Narayan Gand / Nutanben Parmeshwar Gand / 004-00404011 / Surat	Flat No- 303, 3 Floor, Shivay Residency, R.S. No. 272, Block No.200/A, Gokuldhama Villa, Off Surat Bardoli Highway, Talithaya, Palsana, Surat-Gujarat. 394305	13-Jan-20 / Rs. 795486/- (Rupees Seven Lac Ninety Five Thousand Four Hundred Eighty Six Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
9	Saroj Sobhit Mandal / Silesh Sobhit Mandal / Rajesh Sobhit Mandal / 004-0000434 / Surat	Plot No. 493, Sai Deep Residency 2, Block No. 88/P, 101, 102, Jolwa, Near Aaradhana Industrial Estate, Palsana, Dist-Surat, Gujarat - 394327	13-Jan-20 / Rs. 1200395/- (Rupees Twelve Lac Three Hundred Ninety Five Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
10	Yogeshbhai Sureshbhai Dedaku / Yashodha Yogesh Hedau / 004-00402131 / Surat	F No 402, 4 Th Floor, Raj Palace, Soni Park, Talithaya Palsana Surat Gujarat. 394305	07-Feb-20 / Rs. 587269 (Rupees Five Lac Eighty Seven Thousand Two Hundred Sixty Nine Only)	Physical possession Taken On Dtd: 22-10-2021
11	Batuksinh Surajji Jadedja Rajendrasinh Batuksinh Jadedja / 004-00000987 / Surat	401, Ramdev Residency,, Surat-Mumbai Highway,, Kadodara, Surat, Gujarat, 394327	09-Nov-19 / Rs. 925846/- (Rupees Nine Lac Twenty Five Thousand Eight Hundred Forty Six Only)	Physical possession Taken On Dtd: 25-10-2021
12	Dasharathji Maganbhai Thakor / Bharliben Dasharathji Thakor / 004-00402310 / Surat	All The Piece & Parcel Of Immovable Property Bearing Flat No. 103 On The 1st Floor Admeasuring 671.00 Sq. Feet Le 62.58 Sq. Mts. Super Built Up Area & 481 Sq. Feet Le 44.69 Sq. Mts. Built Up Area, Along With Undivided Share In The Land Of "Shukun Residency-2", Situate At Revenue Survey No.1,2,3,5,7,11,12,13,14 & 15, Block No. 1 Paiki Admeasuring He. Area 2-78-17 Sq. Mts. In Ramnagar Society" Paiki Plot No. 21 Of Mouje Antroli, Taluka-Palsana, District-Surat.	26-Nov-19 / Rs. 1407880/- (Rupees Fourteen Lac Seven Thousand Eighty Only)	Physical possession Taken On Dtd: 25-10-2021
13	Gautamkumar Madhubhai Savaliya / Kanchanben Madhubhai Savaliya / 004-00404258 / Surat	Flat No 303,3Rd Floor, Hanikunj Avenue Building No A_e_2,Sai Vatika 2, Off Surat Bardoli Highway, Bagumara, Palsana Surat Gujarat. 394327	13-Jan-20 / Rs. 1019658/- (Rupees Ten Lac Nineteen Thousand Six Hundred Fifty Eight Only)	Physical possession Taken On Dtd: 25-10-2021
14	Sanjay Dineshbhai Raval / Harishidaben Sanjay Raval / 004-00405159 / Surat	Flat No G-2,6r Floor,Shreeji Palace Ramnagar Soc Near Antroli Vlg Palsana Surat Gujarat. 394325	13-Jan-20 / Rs. 1096207/- (Rupees Ten Lac Ninety Six Thousand Two Hundred Seven Only)	Physical possession Taken On Dtd: 25-10-2021
15	Shobhabai Ravindra Khirsagar / Shentadi Shankar Nhav / 004-0000468 / Surat	Flat No. 302, Shukun Residency -1 S No. 1,2,5,7,11,12,13,14,8,15 Block 1 Village Antroli, Surat 394325	24-Jan-20 / Rs. 1035160/- (Rupees Ten Lac Thirty Five Thousand One Hundred Sixty Only)	Physical possession Taken On Dtd: 25-10-2021

Place : Gujarat **Date : 28.10.2021** **Authorised Officer**
For Muthoot Homefin (India) Ltd.

homefirst Home First Finance Company India Private Limited
CIN:U65990MH2010PTC240703, Website: homefirstindia.com Phone No.: 180030008425 Email ID: loanfirst@homefirstindia.com

NOTICE OF SALE THROUGH PRIVATE TREATY

Sale of Secured assets under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 – (Notice Under Rule 8 (6))

The undersigned as Authorized Officer of Home First Finance Company India Limited (Home First) has taken over possession of the schedules property, in terms of section 13(4) of the subject act in connection with outstanding dues payable by you to us. Please refer our Notice dated mentioned below, wherein we informed that we have published Auction Notice in the newspaper mentioned by fixing the Reserve Price as mentioned. The Auction was scheduled on the date as mentioned. The Auction could not be successful due to lack of any bidder.

Public at large is informed that the secured property(ies) as mentioned in the Schedule are available for sale through Private Treaty, as per the terms agreeable to the Company for realisation of Company's dues on "AS IS WHERE IS BASIS" and "AS IS WHAT IS BASIS". Hence, in terms of the provisions of the subject Act and Rules made thereunder, we issue this notice to you to enable you to discharge the amount due to the Company within 15 days from the date of this notice and take back the assets mentioned in the schedule, failing which the assets will be sold to discharge the liabilities. This is without prejudice to any other rights available to the Company under the subject Act or any other law in force.

The interested parties may contact the Authorized Officer for further details/ clarifications and for submitting their offers. Sale shall be in accordance with the provisions of SARFAESI Act/ Rules.

Sr. No.	Name of the Account/ Guarantors	Details of property/ owner of the property	Outstanding amount as on Demand Notice (in INR)	Date of Sale Notice	Newspaper	Date of e-Auction	Reserve Price (in INR)	No. of Authorised Officer
1.	Dhapu Kanwar, Narpat Singh Rajput	Row House-174, Building- D, Haridarshan Residency Plot no 359, Block no. A. R/S/ Block no. 18,19,20, Paikae 1, 21,27, Near Block no 18, Mojeagamb, Sekhpur, Sub District. kamrej, District Surat, Gujarat. 394130	11,74,609	08-Oct-21	Financial Express (Eng +Guj)	25-Oct-21	9,24,000	9913401972
2.	Gudiya Chandan Singh, Chandan Shiv Singh	House on Plot No. 74, Laxmi Residency, Block No 161/A/1, Hyaida, Kim Raod Surat. 394340	8,62,574	08-Oct-21	Financial Express (Eng +Guj)	25-Oct-21	8,10,400	8320607269
3.	Kusum Sanjay Prajapati, Prajapati Sanjaykumar, Uttam Ganga Ram	Flat No. 105, Building- 11, Shree Tirupati Balaji Residency Block 72/B, Karan to Sanki Road, Sanki, Surat Gujarat. 394180	11,08,980	08-Oct-21	Financial Express (Eng +Guj)	25-Oct-21	9,06,400	9902702136

STATUTORY 15 DAYS SALE NOTICE UNDER THE SARFAESI ACT, 2002

The borrower/ guarantors are hereby notified to pay the sum as mentioned in the demand notice along with upto date interest and ancillary expenses before 15 days from the date of this notice, failing which the property will be auctioned/ sold and balance dues, if any, will be recovered with interest and cost.

Date: 28/10/21
Place: Surat

Sd/- Authorised Officer,
Home First Finance Company India Private Limited

Ahmedabad

SHEKHAWATI
SHEKHAWATI POLY-YARN LIMITED
[An ISO 9001:2015 Certified Company]

Extracts of Statement of Unaudited Financial Results for the Quarter and Half year ended September 30, 2021

Sr. No.	Particulars	Quarter Ended			Six Months Ended		Year Ended
		30.09.2021 (Unaudited)	30.06.2021 (Unaudited)	30.09.2020 (Unaudited)	30.09.2021 (Unaudited)	30.09.2020 (Unaudited)	31.03.2021 (Audited)
1	Total income from operations (net)	7,399.02	870.06	551.98	8,269.08	848.23	3,001.81
2	Net Profit / (Loss) for the period from ordinary activities (before Tax, Exceptional and/or Extraordinary items)	(289.62)	(268.57)	(466.30)	(558.18)	(933.07)	(1,143.95)
3	Net Profit / (Loss) for the period before Tax 1 (after Exceptional and/or Extraordinary items)	(289.62)	(268.57)	(466.30)	(558.18)	(933.07)	(1,143.95)
4	Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary items)	(289.62)	(268.57)	(466.30)	(558.18)	(933.07)	(1,143.95)
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))	(286.47)	(265.41)	(464.39)	(551.87)	(928.30)	(1,131.33)
6	Equity Share Capital (Face Value Rs. 1/- per share)	3,447.00	3,447.00	3,447.00	3,447.00	3,447.00	3,447.00
7	Reserve (excluding revaluation reserves) as per balance sheet of previous accounting year	-	-	-	-	-	(12,424.25)
8	Earnings per share (after extraordinary items) (of Rs. 1/- each) *	(0.08)	(0.08)	(0.14)	(0.16)	(0.27)	(0.33)
	(a) Basic	(0.08)	(0.08)	(0.14)	(0.16)	(0.27)	(0.33)
	(b) Diluted	(0.08)	(0.08)	(0.14)	(0.16)	(0.27)	(0.33)

*EPS for interim period is not annualised

Note: The above is an extract of the detailed format of Financial Results for the quarter ended September 30, 2021 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosures Requirements) Regulation, 2015. The full format of the Financial Results for the quarter ended September 30, 2021 is available on www.bseindia.com, www.nseindia.com and www.shekhawatiyam.com.

For and on behalf of Board
Sd/-
Mukesh Ruia
Chairman & Managing Director
(DIN : 00372083)

Place : Mumbai
Date : 26th October, 2021

Registered office:
Plot No. 185/1, Naroli Village, Near Kanadi Phatak, Naroli - 396235,
Dadar & Nagar Haveli (U.T.), Tel. No.: 07226071555, Email: hc@shekhawatiyam.com,
Website: www.shekhawatiyam.com CIN: L17120DN1990PLC000440

RBL BANK LTD.
Administrative Office: 1st Lane, Shahupuri, Kolhapur-416001.

Controlling Office: One India Bulls Centre, Tower 2B, 6th Floor, 841, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai - 400013
National Operation Centre: Techniplex-1, 9th Floor, Off. Veer Savarkar Flyover, Goregaon (West), Mumbai - 400062
Branch office at: RBL Bank Ground Floor, My Home Jugalji, D No. 6-3-885, Opp. Green Park, Green lands, Ameerpet, Hyderabad 500016.

Securitisation Notice under S. 13(2) of SARFAESI Act, 2002

We, RBL Bank Limited the secured creditor of Applicant & Co-Applieant mentioned in column no.2 below inform you all that your account has been classified as Non-performing Account in our accounts pursuant to your defaults in making payment/repayment of principal and interest.

In spite of our repeated demands you have not paid the amount(s) outstanding in your account(s) and you have not discharged your liabilities. We, therefore, issued notice under section 13(2) of Chapter III of the securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 on 02-06-2021 demanding payment together with further interest applicable at the contracted rates, costs, charges, other moneys to discharge your liabilities in full within 60 days from the date of the notice. Details are given in the table below.

Sr. No.	Name of Borrower, Loan Amount and Loan Account No.	Description of the property mortgaged	NPA Date & Amount O/s
1	1. Mr. Sangalani Gopalbhai Bhikhabhai (Applicant) Plot No 150 B Shivshakti SOC, Hadanagar, Bhavnagar, Gujarat - 364003 2. Mrs. Rekhaben Gopalbhai Sangani (Co-Applieant) Plot No. 150B, Shivshakti, SOC1, Hadanagar, Chitra, Bhavnagar, Gujarat - 364003 3. Mr. Saglani Arpit Gopalbhai (Guarantor/Co-Borrower) Plot No. 150B, Shivshakti Society, Bhavnagar, Gujarat-364003. Loan No. : 809002593264 Loan Amount : Rs. 31,30,000/-	Property Owned By: Mr. Gopalbhai Bhikhabhai Sangalani All that right, title and interest of Property Plot No.150/B land admeasuring 185.31 Sq. Mtrs. with construction of Shiv -Shakti Co. Op. Housing Society Ltd., N.A. land of Revenue Survey No. 168, paiki, of Village - Chitra, Taluka & District - Bhavnagar and Bounded as under : North - Plot No. 151/A, South - Plot No. 150/A, East - Road, West- Plot No. 141-B	NPA Date: 07-05-2021 Total amount of Rs. 33,92,099.21/- Outstanding due as on 01-06-2021
2	1. Mr. Dharmesh Kurjibhai Donga (Applicant) Plot No. 32, Santosh Nagar, TulsiPark, 2nd Street, 150 Feet Ring Road, Rajkot, Gujarat - 360004. 2. Mrs. Sejalben Dharmeshbhai Donga (Co-Applieant) Plot No. 32, Santosh Nagar, TulsiPark, 2nd Street, 150 Feet Ring Road, Rajkot, Gujarat - 360004. 3. Mrs. Ambaben Kurjibhai Donga (Guarantor/Co-Borrower) Plot No. 32, Santosh Nagar, TulsiPark, 2nd Street, 150 Feet Ring Road, Rajkot, Gujarat-360004 Loan No. : 809001696249 Loan Amount : Rs. 25,00,000/-	Property Owned By : Mrs. Ambaben Kurjibhai Donga Residential Flat No. 2 having built-up area Sq. Mts. 50-00 situated on the First Floor of the building known as "Om Apartment" constructed on Land of Plot No.23 of Revenue Survey No. 130 paikae of village Mavdi, District Rajkot in the State of Gujarat. Boundaries: North - Passage & Flat No.3, South - Open Space, East - Flat No.1, West-Houses of Omnagar Paikae	NPA Date: 07-05-2021 Total amount of Rs. 20,26,467.29/- Outstanding due as on 01-06-2021
3	1. M/s. Exalt Minechems Rep. By Mr. Yashpalsinh Jatubha (Applicant) SR No 55 Bhuj Naliya, State Highway 49, Nandra Abdasa, Kachchh, Gujarat - 370650. 2. Mr. Jatubha Satubha Rathoda (Co-Applieant) Comon Plot 1 Airport Ring Road, Seven Sky Banglows, Kachchh, Gujarat - 370001. 3. Mr.		

